

M.Com Semester - 2 (CBCS) Examination
March/April – 2024 (As Per Syllabus Year-2023)
CORPORATE FINANCIAL REPORTING

Time: 2:30 Hours

Marks: 70

Instructions:

1. All questions are compulsory.
2. Figures to the right indicate marks.

પ્રશ્ન-૧ નીચેનાં મહેશ લિમિટેડનાં પાકા સરવૈયા માટે સામાન્ય માપનું નાંણાકીય પત્રક તૈયાર કરો. (૨૦)

જવાબદારીઓ	31-3-23 (રૂ.)	31-3-24 (રૂ.)	મિલકતો	31-3-23 (રૂ.)	31-3-24 (રૂ.)
ઈક્વિટી શેરમૂડી	10,00,000	20,00,000	કાયમી મિલકતો	8,00,000	20,00,000
પ્રેફરન્સ શેરમૂડી	2,00,000	4,00,000	રોકાણો	6,00,000	2,00,000
સામાન્ય અનામત	2,00,000	5,00,000	દેવાદારો	4,00,000	8,00,000
નફા-નુકસાન ખાતું	4,00,000	6,00,000	આખર સ્ટોક	2,00,000	8,00,000
લેણદારો	2,00,000	4,00,000	રોકડ	1,00,000	2,00,000
ચૂકવવાનાં બાકી ખર્ચા	1,00,000	1,00,000			
	21,00,000	40,00,000		21,00,000	4,00,000

અથવા

પ્રશ્ન-૧ રાકેશ લિ. ની નીચેની માહિતિ પરથી પાકુ સરવૈયું તૈયાર કરો.

સ્ટોક ચલનદર(વેચેલ માલની પડતર/આખર માલનો સ્ટોક)	6 વખત
કાચા નફાનો ગુણોત્તર	20%
ચાલુ ગુણોત્તર	2.5
પ્રવાહી ગુણોત્તર	1.5
કાર્યશીલ મૂડી	રૂ. 7,50,000
કાયમી મિલકતનાં ઉથલાનો ગુણોત્તર (વેચેલ માલની પડતર સાથે)	2 વખત
સરેરાશ ઉધરાણીની મુદત (વર્ષના 360 દિવસો)	60 દિવસ
કાયમી મિલકતો સાથે શેરહોલ્ડર્સનાં ભંડોળનું પ્રમાણ	0.80:1
અનામત અને વધારા સાથે મૂડીનું પ્રમાણ	0.50:1
લાંબાગાળાની લોન સાથે શેરહોલ્ડર્સનાં ભંડોળનું પ્રમાણ	0.20:1

પ્રશ્ન-૨ નીચેની માહિતિને આધારે વર્તમાન પડતર હિસાબી પધ્ધતિ(CCA) હેઠળ ગિયરિંગ હવાલાની ગણતરી કરો. (૨૦)

વિગત	01-04-2023 (રૂ.)	31-03-2024 (રૂ.)
રૂપાંતરિત ડિબેચરો	20,00,000	24,00,000
બેંક ઓવરડ્રાફ્ટ	12,00,000	16,00,000
રોકડ	2,00,000	6,00,000
ભરપાઈ થયેલ શેરમૂડી	30,00,000	40,00,000
અનામતો	10,00,000	16,00,000

(1) વેચાણ પડતરનો હવાલો(COSA)	રૂ. 4,00,000
(2) નાંણાકીય કાર્યશીલ મૂડી હવાલો(MWCA)	રૂ. 3,00,000
(3) ધસારો	રૂ. 1,00,000
કુલ	રૂ. 8,00,000

અથવા

પ્રશ્ન-૨ જય કંપનીનું તા. 31-03-2023 નાં રોજનું પાકુ સરવૈયુ નીચે પ્રમાણે છે.

જવાબદારીઓ	રૂ.	મિલકતો	રૂ.
ઈક્વિટી શેરમૂડી	10,00,000	કાયમી મિલકતો	12,00,000
અનામતો	4,00,000	સ્ટોક	2,00,000
તારણવાળી લોન	4,00,000	દેવાદારો	4,00,000
લેણદારો	2,00,000	રોકડ-બેંક	2,00,000
	20,00,000		20,00,000

વર્ષ 2023-24 દરમિયાન કુલ ખરીદ-વેચાણ અને સંચાલન ખર્ચા અનુક્રમે રૂ. 10,00,000, રૂ. 16,00,000 અને રૂ. 2,00,000 હતા.

કાયમી મિલકતો પર 10% લેખે ધસારો ગણાય છે. તા. 31-03-2024 નાં રોજ સ્ટોક રૂ. 3,20,000, દેવાદારો રૂ. 5,00,000, લેણદારો રૂ. 2,40,000 અને રોકડ સિલક રૂ. 5,40,000 હતા.

સામાન્ય ભાવ સપાટીનાં આંક નીચે મુજબ હતા.

તા. 31-03-2023 નાં રોજ 400

તા. 31-03-2024 નાં રોજ 600

વર્ષ 2023-2024 સરેરાશ 480

ઉપરની માહિતિને આધારે ઐતિહાસિક પડતર પદ્ધતિ મુજબ તેમજ વર્તમાન ખરીદ શક્તિ(CPP) પદ્ધતિ મુજબ ભાવસપાટીમાં થયેલા ફેરફારની અસર આપી વાર્ષિક હિસાબો તૈયાર કરો.

પ્રશ્ન-૩ જયેશ કંપની લિમિટેડનાં નીચેના આવક-ખર્ચનાં પત્રકમાંથી મૂલ્યવૃદ્ધિનું પત્રક તૈયાર કરો.

(૧૫)

તા. 31-03-2024નાં અંતનું આવક-ખર્ચનું પત્રક

વિગત	રૂ.	રૂ.
વેચાણ	40,00,000	
બાદ: માલસામાનની પડતર	18,00,000	22,00,000
બાદ: (1) મજૂરી	8,00,000	
(2) ધસારો	2,00,000	
(3) વ્યાજ	4,00,000	14,00,000
કરવેરા પહેલાનો નફો		8,00,000
બાદ: કરવેરા		4,00,000
કરવેરા બાદનો નફો		4,00,000
બાદ: ડિવિડન્ડ		2,00,000
રાખી મૂકેલ કમાણી		2,00,000

અથવા

પ્રશ્ન-૩ આર્થિક મૂલ્ય વૃદ્ધિ અને બજાર મૂલ્ય વૃદ્ધિ વિશે સમજાવો.

પ્રશ્ન-૪ કંપનીલક્ષી નાંણાકીય અહેવાલ પ્રેષણનો અર્થ અને હેતુઓ સમજાવો.

(૧૫)

અથવા

પ્રશ્ન-૪ નાણાંકીય અહેવાલ પ્રેષણ માહિતિનું ગુણવત્તાયુક્ત લાક્ષણિકતાઓ સમજાવો.

ENGLISH VERSION

Que-1 Prepare common size financial statement for Balance sheets of Mahesh Ltd. as under. (20)

Liabilities	31-3-23 (Rs.)	31-3-24 (Rs.)	Assets	31-3-23 (Rs.)	31-3-24 (Rs.)
Equity share capital	10,00,000	20,00,000	Fixed Assets	8,00,000	20,00,000
Preference share capital	2,00,000	4,00,000	Investments	6,00,000	2,00,000
General Reserve	2,00,000	5,00,000	Debtors	4,00,000	8,00,000
Profit and Loss Account	4,00,000	6,00,000	Closing Stock	2,00,000	8,00,000
Creditors	2,00,000	4,00,000	Cash	1,00,000	2,00,000
Outstanding Expenses	1,00,000	1,00,000			
	21,00,000	40,00,000		21,00,000	4,00,000

OR

Que-1 Prepare balance sheet from the following information of Rakesh Ltd.

Stock Turnover(Cost of sales/closing stock)	6 Times
Gross profit Ratio	20%
Current Ratio	2.5
Liquid Ratio	1.5
Working Capital	Rs. 7,50,000
Fixed Assets Turnover Ratio (with cost of sales)	2 Times
Average Collection period (Annual 360 days)	60 Days
Proportion of shareholder's fund with fixed assets	0.80:1
Proportion of capital with Reserve and surplus	0.50:1
Proportion of shareholder's funds with long term Loan	0.20:1

Que-2 From the data given below calculate the gearing adjustment required under current cost Accounting (CCA) method. (20)

Particular	01-04-2023 (Rs.)	31-03-2024 (Rs.)
Convertible Debentures	20,00,000	24,00,000
Bank overdraft	12,00,000	16,00,000
Cash	2,00,000	6,00,000
Paid up share capital	30,00,000	40,00,000
Reserves	10,00,000	16,00,000

- (1) Cost of sales Adjustment(COSA) Rs. 4,00,000
 (2) Monetary working capital Adjustment Rs. 3,00,000
 (3) Depreciation Rs. 1,00,000
 Total Rs.8,00,000

OR

Que-2 Following is the balance sheet of Jay company as on 31-03-2023.

Liabilities	Rs.	Assets	Rs.
Equity share capital	10,00,000	Fix Assets	12,00,000
Reserves	4,00,000	Stocks	2,00,000
Mortgage Loan	4,00,000	Debtors	4,00,000
Creditors	2,00,000	Cash-bank	2,00,000
	20,00,000		20,00,000

During year 2023-24 total purchase, sale and administrative expenses are Rs. 10,00,000, Rs. 16,00,000 and Rs. 2,00,000 each Respectively.

Calculate 10% Depreciation on fix assets, Rs. 3,20,000 is stock, Rs. 5,00,000 is debtors, Rs. 2,40,000 is creditors and Rs. 5,40,000 is on cash on hand as on Dt. 31-03-2024.

Normal Price base index is as Follows:-

Dt. 31-03-2023: 400

Dt. 31-03-2024: 600

Average of year 2023-24: 480

Use above Information and prepare final accounts as per historical cost method and current purchasing power method (CPP).

- Que-3 Prepare a value-added statement from the following income Expenditure statement of the Jyoti Co. Ltd. (15)

Income-Expenditure statement for the year ended on 31-03-2024

Particulars	Rs.	Rs.
Sales	40,00,000	
Less: Cost of Material	<u>18,00,000</u>	22,00,000
Less: (1) Wages	8,00,000	
(2) Depreciation	2,00,000	
(3) Interest	<u>4,00,000</u>	<u>14,00,000</u>
Profit of before taxation		8,00,000
Less: Tax		<u>4,00,000</u>
Profit after Tax		4,00,000
Less: Dividend		<u>2,00,000</u>
Retained Earning		2,00,000

OR

- Que-3 Explain about Economic value added and market value added.
Que-4 Explain the meaning and objectives of corporate financial reporting. (15)

OR

- Que-4 Explain the qualitative characteristics of financial reporting information.
